

## સાંપ્રતસમસ્યાઓનું સમાધાન: સંસ્કૃતમૂલ્યશિક્ષણ

રાજ્યગુરુ હિતા

મદદનીશ પ્રાધ્યાપક, સંસ્કૃત

કવિશ્રી બોટાડકર આર્ટ્સ એન્ડ કોમર્શ કોલેજ, બોટાડ

સાંપ્રત સમયમાં આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ કે કોઈ ક્ષેત્ર એવું નથી. જ્યાં કોઈ પણ સમસ્યા ન હોય. સવારે છાપું હોથમાં ત્યાજ સમસ્યાઓનો ઢગલો. માનવજીવન આનંદને બદલે સમસ્યાઓનું જીવન બની ગયું હોય તેવું અનુભવાય છે. કોઈ પણ વ્યક્તિને મળો તો તેની પાસે પોતાની સમસ્યાની હારમાળા ફેરે, કોઈ પણ કુટુંબ પાસે જાત સમસ્યા વિનાનું નહીં હોય. સામાજિક ક્ષેત્ર હોય, રાજકાર્ય ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય – સમસ્યા તો હોવાની જ. તો શું આ સમસ્યાઓનું કોઈ સમાધાન જ નથી? એવું પણ નથી કે આ સમસ્યાઓ આજકાલ જ ઉપરિસ્થિત થયેલી છે. જ્યારથી માનવનું અસ્તિત્વ છે ત્યારથી માનવ કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરતો આવ્યો છે. કદાચ સમસ્યાનું સ્વરૂપ બદલાય છે, પણ તેનું અસ્તિત્વ રહે જ છે. આજી માનવજાત મૂલ્યવાન અનુભવે છે, સમસ્યાઓ સામે બાધ ભીડીને જાણે કે થાકી ગઈ છે, હારી ગઈ છે ત્યારે આપણાને પણ વિચાર આવે કે શું આપણે આપણી ભાવિ પેઢીને કોઈ સમાધાન નહીં આપી શકીએ? તેને નિરાશ કરીશું?

મનુષ્ય ખરા દિલથી વિચારે તો સમસ્યાનું સમાધાન મળો જ. આપણાં સમૃદ્ધ સંસ્કૃતસાહિત્ય પાસે પ્રત્યેક સમસ્યાનું સમાધાન છે. તેને સમજી, સ્વીકારી જીવનમાં આચરણથી પ્રત્યેક સમસ્યા દૂર કરી શકાય છે. પછી તે કૌટુંબિક હોય, સામાજિક હોય, રાજકીય હોય કે શૈક્ષણિક હોય. આ સમાધાન છે : મૂલ્ય શિક્ષણ.

### કૌટુંબિક સમસ્યા:

માનવ સૌ પ્રથમ જે માનવ સમુદ્દરના સંપર્કમાં આવે છે તે છે: કુટુંબ. અહીંથી તેની માનવ બનવાની પ્રક્રીયા શરૂ થાય છે અને તે સાથે સમસ્યા પણ. આપણો ત્યાં કહેવત છે: ઘેરઘેર માટીના ચૂલા. પ્રત્યેક ઘરે કોઈ ને કોઈ સમસ્યા તો હોય જ છે. કુટુંબના સભ્યો વચ્ચે મતભેદ હોય છે. આ મતભેદને મનભેદમાં પરિણામતા વાર લાગતી નથી અને પરિણામે છાય છે-કૌટુંબિક યુદ્ધ. પછી નાનામોટા કે સારાસારનો વિવેક રહેતો નથી અને કુટુંબ છિન્નભિન્ન થઈ જાય છે. વ્યક્તિ ભાંગી પડેછે., હતાશ થાય છે, નિરાશ થાય છે. વ્યક્તિની અસર સમાજ પર થયા વિના રહેતી નથી કેમકે સમાજ વ્યક્તિના જ બનેલો છે. સ્વસ્થ સમાજ માટેની પહેલી શરત છે-સ્વસ્થ, સમસ્યા વિહીન કુટુંબ. પણ આજ તે ક્યાં મળે? કુટુંબને સમસ્યા વિહીન બનાવવામાર્ય સંસ્કૃતસાહિત્ય દર્શાવે છે, તે છે: ત્યાગ. જ્યાં ત્યાગની ભાવના ફેરે ત્યાં કોઈ પણ સમસ્યા આપોઆપ નહીં ટકે. પરિવારનો કોઈ એક સભ્ય વધુ લેવાની દરશા શરેતો ટકશાવ થાય ને? તેના બદલે ત્યાગની ભાવના હોય તો ? તેથી જ આપણા જ્ઞાની ઋષિઓએ કદ્યું છે - તેને ત્યક્તેન મુજીથા:<sup>1</sup> મહાભારત મનુષ્યને એકલા સ્વાદિષ્ટ જમવાની ના કહેતા જણાવે છે: ·એક: સ્વાદુ ન મુજીત.<sup>2</sup> ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન હોય પરંતુ એકલા આરોગ્યવામાં આવે તો તે રૂચિકર બનતું નથી તેમજ ભોજન લીધાનો આનંદ પણ પ્રાપ્ત થતો નથી. માટે જ એકલા ભોજન ન લેવું જોઈએ. વેદમાં જણાવ્યા પ્રમાણો આતિથ્ય એ ગૃહસ્થનો સદ્ગુણ છે. જો વ્યક્તિ પોતાનું ભોજન અન્ય વ્યક્તિઓ સાથે વહેંયે છે તે જ આદર્શ ગૃહસ્થ કહેવાય. આ